

જાતન અને તક લક્ષી આયોજન



ઓન્ટેરિઓનં કરકસરલક્ષી રાજકોષીય ધ્યાન

અનિશ્ચિત અને પડકારરૂપ વૈશ્વિક પરિસ્થિતિ હોવા છતાં સમગ્ર પ્રાંતના લોકો અને વ્યવસાયોના યોગદાનને કારણે 2017 માં ઓન્ટેરિઓના અર્થતંત્રનો વિકાસ થયો હતો. આર્થિક વિકાસ અને સુદ્રઢ રાજકોષીય વ્યવસ્થાપન, 600 મિલિયન ડોલરથી વધુ અંદાજિત પુરાંત આપીને 2017-18માં અંદાજપત્રને સંતુલિત કરવાની પોતાની વચનબદ્ધતા પરિપૂર્ણ કરવા તરફ ઓન્ટેરિઓને દોરી રહ્યું છે. 2024-25 માટે અનુમાનિત સમતોલ અંદાજપત્ર સાથે - 2018-19 થી શરૂ કરીને, રાજ્ય સ્થાનિક ઉત્પાદનોની કુલ કિંમત (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ્સ-જીડીપી) ના એક ટકા કરતાં પણ ઓછી નજીવી ખાધનું અનુમાન કરી રહ્યું છે અને તે સંતુલિત અંદાજપત્ર યોજના માટે પ્રતિબદ્ધ છે જે રાજકોષીય જવાબદારી સાથે જાહેર સેવાઓમાં મહત્વપૂર્ણ મૂડીરોકાણો કરવા પર ભાર મુકે છે.



નક્કર આર્થિક કામગીરી

2014 થી વાસ્તવિક જીડીપી કેનેડા અને બીજા બધા G7 દેશો કરતા ઝડપથી વધી રહી છે.



સંતુલિત અંદાજપત્ર

સળંગ નવમા વર્ષે પણ ઓન્ટેરિઓના નાણાકીય લક્ષ્યાંકને વટાવી 2017-18માં 600 મિલિયન ડોલરથી વધુ પુરાંત અંદાજ રહ્યું છે.



રોજગાર વૃદ્ધિ

મંદી પછી 800,000 થી વધુ નવા રોજગારોની ચોક્કમી વૃદ્ધિ અને 17 વર્ષોમાં નીચામાં નીચો બેરોજગારીનો દર. ગત વર્ષે, દરરોજ, સરેરાશ, 500 નવી નોકરીઓ સર્જવામાં આવી હતી.

ઓન્ટેરિઓનું રાજકોષીય ચિત્ર

ઓન્ટેરિઓ પ્રાંત:

- સ્વાસ્થ્ય સેવાઓ, ગૃહ સંભાળ, માનસિક સ્વાસ્થ્યસેવાઓ, બાળસેવાઓ અને બીજી અનેક સંભાળ અને સેવાઓ જેના પર લોકો આધાર રાખે છે તે પૂરી પાડવા આગામી ત્રણ વર્ષોમાં 20.3 બિલિયન ડોલરના નવા મૂડીરોકાણો કરી રહ્યો છે.
- પ્રાંતના જવાબદારીપૂર્વકના રાજકોષીય વ્યવસ્થાપનનો પુર્વાનુભવ ઉપયોગમાં લઈ આ રોકાણો થઈ રહ્યા છે, જે 2018-19 માં 6.7 બિલિયન ડોલર, 2019-20 માં 6.6 બિલિયન ડોલર, અને 2020-21માં 6.5 બિલિયન ડોલરની અંદાજિત ખાધમાં પરિણમશે અને 2024-25 માં સંતુલિત બજેટમાં આયોજિત પુનર્ગમન કરશે.
- વર્ષ 2017-18 દરમિયાન સૌથી ઓછો માથાદીઠ પ્રોગ્રામ ખર્ચ ધરાવતો પ્રાંત રહે તેવી અપેક્ષા છે.
- કુલ મહેસુલી આવક 2018-19 માં 152.5 બિલિયન ડોલરથી વધીને 2020-21 માં 163.8 બિલિયન ડોલર થઈ જવાનો અંદાજ છે, જે સતત ગતિશીલ આર્થિક વૃદ્ધિના અનુમાનથી પ્રેરિત છે.
- ટકાઉ અને અત્યાવશ્યક જાહેર સેવાઓને સમર્થન આપતા, પ્રાંતના કાર્યક્રમો પાછળ થનારો ખર્ચ 2018-19 અને 2020-21 વચ્ચેના ગાળામાં 145.9 બિલિયન ડોલરથી વધીને 155.8 બિલિયન ડોલર થવાની આગાહી કરી છે.
- સેવાઓનું વિતરણ વધારે પ્રજા-કેન્દ્રી બનાવવા અભિનવ દૃષ્ટિકોણ અપનાવી બધી સેવાઓમાં બેવડી સેવાઓ ઘટાડીને, કાર્યક્રમ વિતરણમાં એકસુત્રતા લાવી રહ્યું છે અને હાલના સોતોની પુનઃ ફાળવણી કરી રહ્યો છે.
- 2021 સુધીમાં વાસ્તવિક જીડીપીમાં સરેરાશ 1.9 ટકા વૃદ્ધિની આગાહી કરી રહ્યો છે.
- નિકાસો અને વ્યવસાયલક્ષી રોકાણ ઓન્ટેરિઓની આર્થિક વૃદ્ધિમાં મહત્વના હિસ્સેદારો થશે એવી અપેક્ષા છે.

ઋણ વ્યવસ્થાપન માટે ઓન્ટેરિઓનો અભિગમ

વર્ષ 2000 ના 15 સેન્ટની સરખામણીએ, દેવા ખર્ચ પરનું વ્યાજ હવે દરેક ડોલરના રાજસ્વ પર 8 સેન્ટ છે.

જવાબદારીપૂર્વકની ઋણવ્યવસ્થા જાળવવા, ઓન્ટેરિઓ પ્રાંત:

- પાછલા 25 વર્ષોમાં ડેટ-ટુ- રેવન્યુ રેશિયો પર સૌથી નીચી વ્યાજયુકવણીની સિદ્ધિ મેળવી છે, જે ઓન્ટારીયોના લોકોને સીધો લાભ આપે તેવા કાર્યક્રમો પાછળ પ્રાંતને વધુ મહેસુલી ડોલર ખર્ચવા સમર્થ બનાવે છે.
- રોકડ અનામતોના સરેરાશ સ્તરને 30 બિલિયન ડોલરથી ઉપર જાળવી રાખીને, હાલમાં અને ભવિષ્યમાં, પોતાની નાણાકીય જવાબદારીઓ પહોંચી વળવા પ્રાંત મદદ કરી રહ્યો છે.
- પ્રાંતના ઋણ પોર્ટફોલિયો માટે લાંબો સરેરાશ ગાળો જાળવી રાખવા નીચા વ્યાજ દરો અને ઓન્ટારીયો બોન્ડ્સની જબરદસ્ત માંગ પર પ્રાંત મદદ રાખી રહ્યો છે.
- સમગ્ર પ્રાંતમાં પરિવહનના અને અન્ય પર્યાવરણને અનુકૂળ કામો માટે ઓન્ટેરિઓને નાણા ફાળવવામાં મદદ કરવા એક મહત્વપૂર્ણ સાધન તરીકે, ઓન્ટેરિઓના ઋણ કાર્યક્રમના એક ભાગરૂપ, ગ્રીન બોન્ડ પ્રોગ્રામનું વચન આપી રહ્યો છે.